



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩

કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦



તા.૧૨/૦૮/૨૦૧૮ બુધવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૭૭૪/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૩ કેસ કરી, ૩૩ વ્યક્તિઓને ઝડપી, ૧૬૬ લીટર દેશી દારૂ કબજે કર્યો હતો. તેમજ જુગાર ધારા હેઠળ ૪ કેસ કરી ૧૧ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૬,૪૩૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૭૭૫/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૮૭ વ્યક્તિઓની અટકાયત કરી હતી તેમજ પ્રોહી ૯૩ મુજબ ૮ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

ચોરી :-

સમાચાર યાદી નં.૧૭૭૬/૧૮

**કૃષ્ણનગર:** રાકેશભાઈ રમણભાઈ પરમાર (ઉ.વ.૩૬)(રહે,જીલધારા પાર્ક, ન્યુ અમરપાર્ક ની પાછળ સજલ પાર્કની બાજુમા નરોડા) તા.૩૧/૮/૧૮ બપોરના ૩/૩૦ વાગ્યાના સુમારે હરીદર્શન એસ.બી.આઇ.શાખાની બેંકમાં રાકેશભાઈ જ્યારે પૈસા ભરવા માટે લાઇનમા ઉભા હતા ત્યારે બે અજાણ્યા ઇસમો (૩૫ થી ૪૦ વર્ષના આશરાના) એ રાકેશભાઈની નજર ચુકવી રૂપિયા ૩૫,૦૦૦/- ચોરી લઇ નાસી ગયા હતા. આ અંગેની ફરિયાદ રાકેશભાઈ પરમારે તા.૧૧/૮/૧૮ નારોજ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જે.બી.ચૌહાણ ચલાવે છે.

**મેઘાણીનગર:** સુનીતાબહેન વા/ઓ સતીષકુમાર પાંડે (ઉ.વ.૪૫)(રહે.શીવશક્તિ સોસાયટી વી.વી.તોમર સ્કુલ પાસે વિધ્યાનગર ભાર્ગવ રોડ મેઘાણીનગર) તા.૧૧/૮/૧૮ કલાક ૧૧/૩૦ થી ૧૨/૧૫ વાગ્યા દરમ્યાન મેઘાણીનગર પૂજા હોસ્પિટલની બાજુમા એસ.બી.આઇ.બેંકમા પૈસા ઉપાડવા માટે ગયેલ હતા દરમ્યાન બેંકમા ભીડનો લાભ લઇ અજાણી વ્યક્તિએ સુનીતાબહેનની નજર ચુકવી તેમના પર્સને કોઈ વસ્તુથી ચીરો કરી પર્સમાંથી રોકડ રૂપિયા ૭૦,૦૦૦/- ચોરી કરી લીધી હતી.આ અંગેની ફરિયાદ સુનીતાબહેન પાંડે એ મેઘાણીનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.ઓ.ચૌધરી ચલાવે છે.

**બાપુનગર:** પ્રકાશભાઈ ઘાસીરામ તૈલી (ઉ.વ.૨૬)(રહે.શિવનગર સોસાયટી રબારી કોલોની અમરાઈવાડી) એ તા.૦૫/૦૯/૧૮ રાતના ૧૦/૦૦ બાપુનગર ગુજરાત બોટલીંગ સરદાર વલ્લભ એસ્ટેટ આગળ પોતાની આઈશર ગાડી નંબર જીજી.૨૭.વી.૦૫૪૯ કિમત રૂપિયા ૧૦,૦૦,૭૮૬/- પાર્ક કરી હતી. જેની ચોરી તા.૦૬/૦૯/૧૮ સવારના ૬/૦૦ વાગ્યા દરમ્યાન થઈ હતી. આ અંગેની ફરીયાદ પ્રકાશભાઈ તૈલી એ તા.૧૧/૯/૧૮ નારોજ બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ હે.કો.શ્રી જીતેન્દ્રકુમાર તખતદાન ચલાવે છે.

**નિકોલ:** મોહનલાલ ગોપીલાલ ગુર્જર (રહે,શ્યામવીલા સોસાયટી, પ્રેરણા સોસાયટીની સામે કઠવાડા સીંગરવા રોડ તા.દસ્ક્રોઈ જી.અમદાવાદ) એ તા.૦૭/૦૯/૧૮ રાતના ૧૦/૦૦ પોતાના ઘર નજીક પોતાની બોલેરો પિકઅપ ગાડી નંબર જીજી.૦૧.ડી.ઝેડ.૫૬૭૫ કિમત રૂપિયા ૨,૫૦,૦૦૦/- પાર્ક કરી હતી. જેની ચોરી તા.૦૮/૦૯/૧૮ સવારના ૬/૩૦ વાગ્યા દરમ્યાન થઈ હતી. આ અંગેની ફરીયાદ મોહનલાલ ગુર્જરે તા.૧૧/૯/૧૮ નારોજ નિકોલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એસ.વી.પટેલ ચલાવે છે.

અપમૃત્યુ:-

સમાચાર યાદી નં.૧૭૭૮/૧૮

**ઓઢવ:** નંદકિશોર સ/ઓ મદનલાલ ગર્ગ (શર્મા)(ઉ.વ.૨૫)(રહે,પુરગાવ જી.ભીલવાડા વાડ નંબર-૪ ઝાટોના મંદિર પાસે રાજસ્થાન) એ તા.૧૧/૯/૧૮ નારોજ ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૪/૦૮/૨૦૧૮ સાંજના ૫/૦૦ વાગ્યાના સુમારે આરોપી ગણપતલાલ મોહનલાલ દુદાણી (રહે, શેડ નં- ૫૯ વિજય એસ્ટેટમાં દુદાણી મેટલ્સ ભિક્ષુકગૃહની બાજુમાં ઓઢવ) એ ઓઢવ વિજય એસ્ટેટમાં દુદાણી મેટલ્સ ભિક્ષુકગૃહની બાજુમાં શેડ નં-૫૯ ની બાજુમાં આવેલ પોતાની ફેક્ટરીના શેડના સિમેન્ટના પતરા જુના હોવાનું જાણવા છતાં, નંદકિશોરના ભાઈ વિષ્ણુભાઈ (ઉ.વ.૨૧) ને પાણી ન ટપકે તે સારૂ છત ઉપર તાડપતરી ઢાકવા ચઢાવતાં, વિષ્ણુભાઈ નાઓ બાજુમાં આવેલ આગની ભઠ્ઠીમાં પડી જતાં શરીરે દાઝી જતાં સારવાર અર્થે તેમને શારદાબેન હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૨૬/૦૮/૧૮ સાંજના ૭/૦૦ વાગે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ ગુનાની તપાસ હે.કો.શ્રી રાવજી ભીમાજી ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૧૭૭૯/૧૮

**શાહપુર:** સારીકાબહેન ડો/ઓ અશોકભાઈ દાતણીયા (ઉ.વ.૩૯) (રહે. જ્યંતી ચોક નાગોરીવાડ શાહપુર) એ અગમ્ય કારણસર તા.૧૧/૯/૧૮ કલાક ૧૧/૨૦ વાગ્યા પહેલા શાહપુર નાગોરીવાડ તાળીયા મહારાજની વાડી ખાતે ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે શાહપુર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી પી.જી.સોલંકી ચલાવે છે.

**કૃષ્ણનગર:** ગોપી જગદીશભાઈ કાછડીયા (ઉ.વ.૧૪) (રહે.પરીશ્રમ સોસાયટી સુદર્શનપાર્ક સામે ગોપાલપાર્ક પાસે કૃષ્ણનગર) એ અગમ્ય કારણસર તા.૧૧/૯/૧૮ સાંજના ૬/૪૫ વાગ્યાના સુમારે પોતાના ઘરે છતના હુકમાં દુપટ્ટે બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઈ.શ્રી ગોવિંદસિંહ તખતસિંહ ચલાવે છે.

રામોલ: ખુશી ડો/ઓ રાજુભાઇ માડુડા (ઉ.વ.૧૬) (રહે. ચાર માળીયા અયોધ્યાનગર પાસે ન્યુ મણીનગર સી.ટી.એમ રામોલ) એ અગમ્ય કારણસર તા.૧૦/૯/૧૮ સાજના ૭/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે રામોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી એચ.એમ.રબારી ચલાવે છે.

જીઆઈડીસી વટવા: બળદેવસિંહ ઉદેસિંહ મહીડા (ઉ.વ.૫૪) (રહે. વિનોબાભાવેનગર જી.આઈ.ડી.સી વટવા) એ બિમારીથી કંટાળી તા.૧૧/૯/૧૮ કલાક ૮/૦૦ વાગ્યાના સુમારે પોતાના વિનોબાભાવેનગર ગણપતિ ચોક પાસે આવેલ ઇલેક્ટ્રીક ડી.પી. ઉપર ચઢી જીવતા વાયરને પકડી લેતા વિજ કરંટ લાગતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે જીઆઈડીસી વટવા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી એમ.આર.શેઠ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.